



સીટી ઓફ બ્રેમ્પટન જૂન 11 થી રિઓપન કરવા પ્રોવિન્સના રોડમેપનું પગલું એક પર સુરક્ષિત રીતે આગળ વધવાની તૈયારી કરી રહ્યું છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જૂન 7, 2021) – ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયોએ આજે કરેલી ઘોષણા પછી, સીટી ઓફ બ્રેમ્પટન આ શુક્રવારે, જૂન 11 નાં રોજ મળસ્કે 12:01 વાગ્યાથી [રિઓપન કરવા પ્રોવિન્સના રોડમેપનું પગલું એક](#) પર સુરક્ષિત રીતે આગળ વધવાની તૈયારી કરી રહ્યું છે. આ પગલું સ્થાનિક જાહેર આરોગ્ય એકમો, આરોગ્ય સંભાળ ભાગીદારો, મ્યુનિસિપાલિટીઓ સાથેની ભાગીદારીમાં પ્રોવિન્સની રસીકરણની શરૂઆત, અને આપણાં સમુદાયના ચાલુ સમર્પણને આભારી થતા સમયપત્રકથી ત્રણ દિવસ પહેલાં શરૂ થશે.

જૂન 11 થી, [રિઓપન કરવા પ્રોવિન્સના રોડમેપનું પગલું એક](#) હેઠળ નીચેના નિયમો અને ઉપાયો અમલમાં આવશે:

- સામાજિક હળવું-મળવું અને આયોજિત જાહેર પ્રસંગો માટે આઉટડોર મર્યાદાઓ જુદા જુદા ઘરોના સભ્યો સહિત, 10 લોકો સુધી વિસ્તારવામાં આવશે;
- લગ્ન સમારંભ અને અંતિમક્રિયા સહિતની આઉટડોર ધાર્મિક સેવાઓ, વિધિઓ, કે સમારંભો જેમાં લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને વ્યક્તિઓ વચ્ચે બે મીટરનું શારીરિક અંતર જાળવી શકાય;
- લગ્ન સમારંભ અને અંતિમક્રિયા સહિતની ઈનડોર ધાર્મિક સેવાઓ, વિધિઓ, કે સમારંભોમાં ચોક્કસ ઓરડાની 15 ટકા સુધીની ક્ષમતાને પરવાનગી મળે છે;
- અનિવાર્ય-સિવાયના રિટેઇલ માટે 15 ટકા સુધીની ક્ષમતાને પરવાનગી મળે છે, જેમાં વેચી શકાતા માલસામાન પર કોઈ પ્રતિબંધો નથી;
- અનિવાર્ય અને અન્ય પસંદ કરેલા રિટેઇલ માટે 25 ટકા સુધીની ક્ષમતાને પરવાનગી મળે છે, જેમાં વેચી શકાતા માલસામાન પર કોઈ પ્રતિબંધો નથી;
- બહુ વિશાળ ઘરો માટે આઉટડોર ડાઈનિંગમાં અપવાદો સાથે ટેબલ દીઠ ચાર લોકો;
- આઉટડોર ફિટનેસ ક્લાસીસ, અંગત તાલીમમાં આઉટડોર સમૂહો અને આઉટડોર વ્યક્તિગત/ટીમ ધોરણે રમતની તાલીમની પરવાનગી 10 લોકો સુધી જ્યાં વ્યક્તિઓ વચ્ચે ત્રણ મીટરનું અંતર જાળવી શકાતું હોય;
- બાળકો માટે ડે કેમ્પ્સ ચલાવવાની પરવાનગી ઓફિસ ઓફ ધી ચીફ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ દ્વારા નિર્મિત COVID-19 માટેની સુરક્ષા માર્ગરેખાઓ અનુસાર આપવામાં આવે છે;
- ઓન્ટેરિયો પાર્ક્સ, અને ટૂંકા સમય માટે રેન્ટલ સહિત, કેમ્પ મેદાનો અને કેમ્પ સ્થળોમાં રાતભરનો પડાવ (ઓવરનાઈટ કેમ્પિંગ);
- રિહર્સલ કરવા અથવા રેકોર્ડ કરેલ કે પ્રસારિત કન્સર્ટ, આર્ટિસ્ટિક ઈવેન્ટ, થિયેટરલક્ષી પરફોર્મન્સ અથવા 10 થી વધારે પરફોર્મન્સ ન હોય તેવા અન્ય પરફોર્મન્સના હેતુસર કન્સર્ટ સ્થળો, થિયેટરો અને સિનેમા હોલ્સ આઉટડોર્સમાં, અન્ય પ્રતિબંધો સાથે ખુલી શકે;
- આઉટડોર હોર્સ રેસિંગ ટ્રેક્સ અને મોટર સ્પીડવેઝને દર્શકો વિના ચલાવવાની પરવાનગી મળે છે; અને
- પ્રાણી સંગ્રહાલયો (ઝૂ), સિમાચિલ્નો (લેન્ડમાર્ક્સ), ઐતિહાસિક સ્થળો, બોટાનિકલ ગાર્ડન્સ જેવા આઉટડોર આકર્ષણોને ક્ષમતા અને અન્ય પ્રતિબંધો સાથે.

પ્રોવિન્સનો [રોડમેપ ટૂ રિઓપન](#) ત્રણ પગલાનો પ્લાન છે જે સુરક્ષિત રીતે અને સાવચેતીપૂર્વક પ્રોવિન્સને રિઓપન કરે છે અને મહત્વના જાહેર આરોગ્ય અને આરોગ્ય સંભાળ સૂચકાંકોમાં સમગ્ર પ્રોવિન્સમાં રસીકરણ દર અને સુધારાઓ આધારિત જાહેર આરોગ્ય ઉપાયો ધીરે ધીરે ઉઠાવી લેવામાં આવશે.

પ્રોવિન્સનું સમાચાર પ્રકાશન [અહીં](#) વાંચો.

સીટી સેવાઓ અને સગવડો

[સીટી આઉટડોર મનોરંજનલક્ષી સવલતો](#)

છૂટ અપાનારી આઉટડોર મનોરંજનલક્ષી સવલતોમાં ગોલ્ફ કોર્સીસ અને ડ્રાઈવિંગ રેન્જીસ, સોકર અને અન્ય રમતના મેદાનો, બેઝબોલ ડાયમન્ડ્સ અને બેટિંગ કેજીસ, ટેનિસ અને બાસ્કેટબોલ કોર્ટ્સ, લોન બોલિંગ અને બોચી, અને BMX અને સ્કેટ પાર્ક્સ, અને વૈડિંગ પૂલ્સ અને સ્પ્લેશ પેડ્સનો સમાવેશ થાય છે.

પ્રોક્સર્સ લેક બીચ અને અલડોરાડો પાર્ક આઉટડોર પૂલની સીઝન શરૂ થવા સંબંધમાં વિગતો આ મહિને મોરેથી ઉપલબ્ધ થશે.

સીટીની ચોક્કસ સગવડો માટે COVID-19 આરોગ્ય અને સુરક્ષા ઉપાયોના સંબંધમાં રિઓપન થવાનો સમય અને વિગતો જોવા કૃપા કરી વેબસાઈટ જુઓ, www.brampton.ca/summerfun.

સ્પ્લેશ પેડ્સ અને વૈડિંગ પૂલ્સ

સ્પ્લેશ પેડ્સ સમગ્ર શહેરમાં ખુલ્લા છે. ચિંગકુસી પાર્કમાં વૈડિંગ પૂલ્સ જાહેર વપરાશ માટે ફ્રી ખોલવાનું જૂન 11, 2021 થી નિર્ધારિત થયું છે જો હવામાન અનુકૂળ રહે. સમગ્ર શહેરમાં વૈડિંગ પૂલ્સ જૂન 12 થી શરૂ કરીને વીકએન્ડ્સ પર, અને જૂન 26 થી શરૂ કરીને દરરોજ ખોલવામાં આવશે. વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવું અનિવાર્ય છે અને રહેવાસીઓને હાજર રહેતા પહેલાં COVID-19 લક્ષણો માટે જાતે તપાસ કરવાનું કહેવામાં આવે છે. સ્પ્લેશ પેડ્સ અને વૈડિંગ પૂલ્સના સ્થળો અને સંચાલનના કલાકોની યાદી [અહીં](#) ઉપલબ્ધ છે.

રૂબરૂમાં સમર કેમ્પ્સ

સીટી ઓફ બ્રેમ્પટનના નવ જેટલા રિક્રિએશન સેન્ટર્સ બાળકો અને જુવાનો માટે રૂબરૂમાં સમર કેમ્પ્સ જુલાઈ 5 થી શરૂ કરશે. કેમ્પ માટેની નોંધણી જૂન 7 થી શરૂ થઈ. કેમ્પ્સમાં પ્રવૃત્તિઓ જેમ કે ગેમ્સ, સ્પોર્ટ્સ, ક્રાફ્ટ્સ અને ઘણીનો સમાવેશ થાય છે, જે સોમવારથી શુક્રવાર સવારે 8:45 થી સાંજે 5:15 વાગ્યા સુધી ચાલશે. ઓગસ્ટ 2 થી શરૂ થતું અઠવાડિયું જાહેર રજાને લીધે ટૂંકા અઠવાડિયા તરીકે ચાલશે.

પીલ પબ્લિક હેલ્થના માર્ગદર્શન પ્રમાણે સહભાગીઓ અને કર્મચારીગણનું આરોગ્ય અને સુરક્ષાની ખાતરી કરવા સીટી ઓફ બ્રેમ્પટન વધારાના પ્રોટોકોલ્સનો અમલ કરી રહ્યું છે. સહભાગીઓએ ઈનડોર્સમાં બધાં સમયે, અને આઉટડોર્સમાં વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવું શક્ય ન હોય ત્યારે ફેસ મારક્સ પહેરવા અનિવાર્ય છે. કેમ્પ્સને જૂથોમાં વિભાજિત કરવામાં આવશે જેથી તેઓ એકબીજા સાથે પારસ્પરિક સંવાદ કરી શકશે નહીં. વધારે તીવ્ર સફાઈ કાર્યપદ્ધતિઓ, દરરોજ તપાસ, અને ઘણું બધું અમલ કરવામાં આવશે. [રૂબરૂમાં સમર કેમ્પ માટે આરોગ્ય અને સુરક્ષાને લગતી બાબતો પર પૂરી વિગતો માટે અહીં ક્લિક કરો.](#)

ફ્રી અલગ અલગ છે. નોંધણી કરાવવા 3-1-1 નંબર પર કોલ કરો અથવા વેબસાઈટ જુઓ, www.brampton.ca/reccamps.

રસીકરણ

બ્રેમ્પટન સહિત, પીલમાં રહેતી, કામ કરતી કે સ્કૂલે જતી 12 કે વધારે વર્ષની બંધી વ્યક્તિઓ, હવે પસંદ કરેલા ક્લિનિક્સમાં COVID-19 વેક્સિન એપોઈન્ટમેન્ટ નોંધાવી શકે છે. 12 થી 15 વર્ષની ઉંમરના વ્યક્તિઓ માટે એપોઈન્ટમેન્ટ્સ માટે રીજીયન ઓફ પીલની બુકિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને [ઓનલાઈન બુકિંગ](#) કરાવવું રહ્યું. જો કોઈને બુકિંગ કરાવવામાં મદદ જોઈતી હોય તો, તેઓ રીજીયન ઓફ પીલની COVID-19 વેક્સિનેશન લાઈનને 905.791.5202 નંબર પર, સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી, અઠવાડિયામાં 7 દિવસ કોલ કરી શકે છે.

70+ વર્ષની ઉંમરના અને એપ્રિલ 18 પહેલાં Pfizer (ફાઈઝર) કે Moderna (મોડર્ના) રસી લીધી હોય તેવા રીજીયન ઓફ પીલના રહેવાસીઓ માટે બીજા ડોઝનું બુકિંગ્સ હવે ઉપલબ્ધ છે. વેબસાઈટ covid-19.ontario.ca/book-vaccine/ પર અથવા પ્રોવિન્સની બુકિંગ લાઈનને 1-833-943-3900 નંબર પર કોલ કરીને એપોઈન્ટમેન્ટ્સ બુક કરાવી શકાય છે.

COVID-19 રસીકરણ પર સૌથી અદ્યતન માહિતી માટે, પ્રોવિન્સનું [વેક્સિન પોર્ટલ](#) જુઓ.



કડીઓ (લિંક્સ)

- [સીટી ઓફ બ્રેમ્પટન COVID-19 પ્રોગ્રામિંગ અને સર્વિસ અપડેટ્સ](#)
- [સીટી ઓફ બ્રેમ્પટન – શું ખુલ્લું છે, શું બંધ છે](#)
- [ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયોનું વેક્સિન પોર્ટલ](#)
- [રીજીયન ઓફ પીલનું વેક્સિન પોર્ટલ](#)
- [COVID-19 નાં લક્ષણો](#)
- [COVID-19 વેક્સીન \(રસી\)](#)
- [બ્રેમ્પટનમાં ટેસ્ટિંગ](#)
- [સેલ્ફ-આઈસોલેટ કેવી રીતે થવું](#)
- [COVID-19 દરમિયાન ધંધાઓ અને કાર્યસ્થળોને સુરક્ષિત રાખવા](#)
- [પીલમાં COVID-19 નાં કેસીસ](#)

-30-

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca